



# LAXMI GOLDORNA HOUSE LIMITED

CIN : L36911GJ2010PLC059127

To,  
The Manager,  
Listing Department,  
**National Stock Exchange of India Limited,**  
Exchange Plaza,  
Bandra Kurla Complex, Bandra (East),  
Mumbai-400051

Date: 09-09-2025

Dear Sir/Madam,

**Subject: Newspaper Advertisement – “Notice 16<sup>th</sup> Annual General Meeting” , “Information of E-voting”, “Record date for Bonus”, “Book Closure” and Other relevant information.**

**Ref. No.:- Symbol: LGHL, ISIN: INE258Y01016**

This is to inform you that the advertisement on the captioned subject was published on Sunday, 07<sup>th</sup> September 2025 in the following newspaper:

- 1) Western Times (English Language) on page no. 7.
- 2) Western Times (Regional Language) on page no. 7.

The clippings of Ahmedabad edition of the two newspapers listed above are attached for your intimation and records.

Thanking You,  
**For, Laxmi Goldorna House Limited**

**Mr. Jayeshkumar Chinulal Shah**  
**Managing Director**  
**DIN: 02479665**

**Regd. Office:**

Laxmi House, Opp Bandharano Khancho, M.G. Haveli Road, Manekchowk, Ahmedabad - 380001, Gujarat.

**E:** cs@laxmilifestyle.co.in | cs.laxmigold@gmail.com | laxmigroup56@gmail.com

**W:** www.laxmilifestyle.co.in | **Ph:** +91 84888 09999 | +91 98980 33044

**Corp. Address :**

Venus Business Atlantis, Near Prahaladnagar Road, Ahmedabad-380015.



## Dev Accelerator IPO to open on September 10, 2025; Price band at Rs. 56 - Rs. 61 per Equity Share

Ahmedabad, Dev Accelerator Limited ("The Company") shall open its Bid / Issue in relation to its initial public offer (IPO) of Equity Shares on Wednesday, September 10, 2025. The Anchor Investor Bidding Date shall be Tuesday, September 09, 2025. The Bid/Issue will open on Wednesday, September 10, 2025 for subscription and will close on Friday, September 12, 2025. ("IPO Issue Dates") Bids can be made for a minimum of 235 Equity Shares and in multiples of 235 Equity Shares thereafter. ("Bid Details")

The Price Band of the Issue has been fixed at Rs.56 to Rs.61 per Equity Share. The total Issue size of Equity Shares with face value Rs.2 each comprises of fresh issue of Equity Shares aggregating up to Rs.1,433.50 million [Rs.143.35 crore (calculated on Upper Price band)] ("Fresh Issue") ("Total Issue Size"). There is no Offer for Sale (OFS) compo-



nent.

The company proposes to utilize the net proceeds from the fresh issue towards (a) Capital expenditure for fit-outs in the Proposed Centers estimated to Rs.731.16 million [Rs.73 crore]; (b) Repayment and/or pre-payment, in full or part, of certain borrowings availed by our Company including redemption of non-convertible debentures estimated to Rs.350 million [Rs.35 crore]; and (c) balance towards general corporate purposes.

The company offers space solutions in the form of flexible workspaces to their clients. They are one of the largest flex space operators in terms of oper-

ational flex stock in Tier 2 markets (Source: JLL report). The company sources and procure workspaces through the Straight Lease Model, Revenue Share Model, Furnished by Landlord model and the OpCo - PropCo Model. As on May 31, 2025, company have over 250 clients and 28 Centers across 11 cities in India, with 14,144 seats covering a total area under management of SBA 860,522 square feet.

In the financial year 2024-25 (FY25), the company reported revenue from operations of Rs.158.88 crore, up 47 per cent from Rs.108.09 crore in the previous fiscal. Its restated profit after tax

stood at Rs.1.77 crore in FY25, up 305.72% compared to Rs.0.44 crore in FY24. Its adjusted earnings before interest, tax, depreciation and amortisation came in at Rs.80.46 crore in FY25. The Issue is being made through the Book Building Process, in terms of Rule 19(2)(b) of the Securities Contracts (Regulation) Rules, 1957, as amended ("SCRR") read with Regulation 31 of the SEBI ICDR Regulations, wherein not less than 75% of the Net Issue shall be available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs", the "QIB Portion"), provided that our Company in consultation with the BRLM may allocate up to 60% of the QIB Portion to Anchor Investors on a discretionary basis in accordance with the SEBI ICDR Regulations (the "Anchor Investor Portion").

## Havmor Unveils Biscotti Ice Cream - The Ultimate Dessert Indulgence for Every Mood and Moment

Mumbai, With indulgence on the rise and dessert lovers craving more than just flavour, Havmor Ice Cream, a part of LOTTE Wellfood Co. Ltd., brings to India yet another globally inspired innovation, Biscotti Ice Cream known for providing unique experiences, Havmor continues to redefine indulgence through bold & innovative flavours and textures. With this launch, the brand forays into the dessert space, aiming to create the ultimate dessert experience for consumers with its latest offering, Biscotti Ice Cream Biscotti is crafted with 100% milk, generous swirls of velvety Biscotti spread, and crunchy biscuit chunks. Biscotti Ice Cream delivers a delightful balance of caramelised richness, creamy smoothness, and biscuit crunch. The launch is supported by a digital-first campaign centred around the idea that the ice cream

is so delicious, it feels like a "chef's kiss," those perfect bites that leave a lasting impression, much like a chef's approval. The reveal showcased popular influencers Aneri Vajani, Naveen Sharma, Akanksha Singh Gaur, Kanchi Sharma, and Marita Mont tasting the ice cream for the first time—and unanimously crowning it The Ultimate Dessert with a playful chef's kiss. The campaign further unfolds through influencer skills, behind-the-scenes factory glimpses, ASMR-style content, and slice-of-life moments that capture how Biscotti Ice Cream turns every moment into indulgence—be it a workday slump, a late-night craving, or a weekend binge. Its creamy and crunchy combination, caramelised richness, and premium ingredient additions (25.3% Biscotti spread and biscuit bits) make the 750ml Biscotti tub.

## First telecom system with India-made chips gets TEC certification

New Delhi, Sep 6 (IANS) Union Electronics and IT Minister Ashwini Vaishnaw has announced that a telecom system using only domestically-produced chips has received certification from the Telecommunication Engi-

neering Centre (TEC). The minister praised the development on X social media platform, describing it as a "big leap" for the country's semiconductor industry. The minister wrote on X, "Big leap for India's semiconductor story! In a

first, a telecom system running on 'made in India' chips has cleared the standards & quality tests (TEC certification)." TEC certification is the Department of Telecommunications' quality benchmark, ensuring telecom equipment meets strict performance and safety standards. Along with the nod for domestic rollout, the approval has positioned In-

dia's local chips alongside global counterparts, opening export opportunities. The milestone indicates progress in reducing reliance on imported semiconductors, a vulnerability highlighted by recent global shortages. Analysts say India's strategy of enhancing capacity in design, assembly, testing, and integration allows it to address supply chain gaps.

**LAXMI LAXMI GOLDORNA HOUSE LIMITED**  
CIN: L36910GJ2010PLC059513  
Reg. Office : Laxmi House, Opp. Bandharano Khacho, M.G. Haveli Road, Manek Chowk, Ahmedabad-380001, Gujarat, India  
Corporate Office: 503, Venus Business Atlantis, Nr. Prahaladnagar Garden, Jodhpur Char Rasta, Ahmedabad, Gujarat, India, 380015.  
Email : cs@laxmifirststyle.co.in Website : www.laxmifirststyle.co.in

### NOTICE OF 16<sup>TH</sup> ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 16th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Tuesday, September 30, 2025 at 03:00 P.M. through video Conferencing (VC)/Other Audio Visual Means ("OAVM") pursuant to applicable provisions of the Companies Act, 2013 and the rules made under SEBI (Listing Obligation & Disclosure requirement) Regulations, 2015 and MCA circular dated May 5, 2020 read with circular dated April 8, 2020 and April 13, 2020, SEBI circular dated May 12, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021 and all other relevant circulars issued from time to time, without physical presence of the members at a common venue to transact the business as set out in the Notice of AGM.

The Company has completed dispatch of the Notice of AGM and Annual Report for the Financial year 2024-25 to Members through permitted mode whose email-id is registered with depository participant or the company. The Notice of the AGM is available on the website of the Company at [www.laxmifirststyle.co.in](http://www.laxmifirststyle.co.in) and at NSE Limited [www.nseindia.com](http://www.nseindia.com).

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Members are provided with the facility of remote e-voting to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using electronic voting system provided by National Depository Services (India) Limited from a place other than the venue of the AGM ("Remote e-voting") and the business may be transacted through such voting. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Tuesday, 23rd September, 2025 (cut-off date). The details as required under relevant provisions of the companies act, 2013 and rules made thereunder are given below:

1. Date & Time of Commencement of E-voting	Friday, 26 <sup>th</sup> September, 2025 at 09:00 A.M.
2. Date & Time of end of E-voting	Monday, 29 <sup>th</sup> September, 2025 at 05:00 P.M.
3. Cut-off date for determining rights of entitlement for e-voting	Tuesday, 23 <sup>rd</sup> September, 2025 at 05:00 P.M.
4. Those persons who have acquired shares and have become members of the company after emailing of notice of AGM by the company and whose names appear in the Register of Members of the company / in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through e-voting by following the procedure as mentioned in the Notice of AGM	
5. Remote E-voting shall not be allowed beyond Monday, 29th September, 2025 at 05:00 P.M.	
6. E-voting will be available during AGM. Members who have already casted their vote by remote E-voting prior to the AGM may remain present at AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again	

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 23rd September, 2025 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting. Any person who acquires the shares as on cut off dates, may obtain login id password by sending a request at [helpdesk.evoting@nsdlindia.com](mailto:helpdesk.evoting@nsdlindia.com). However, if such a person is already registered with NSDL for e-voting, then the existing user ID and password can be used for casting their vote.

In case of any grievances connected with facility for voting by electronic means, please contact Mr. Dhaval Parekh, Company Secretary at email id [cs@laxmifirststyle.co.in](mailto:cs@laxmifirststyle.co.in) or Number +918488809999. For details relating to remote e-voting, e-voting during AGM, members holding shares in physical mode, demat mode and for those members whose email-id is not registered, please refer to the Notice of AGM. In case of any queries relating to voting by electronic means, please refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available at [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com) or write an email [evoting@nsdl.com](mailto:evoting@nsdl.com) or in contact at toll free no. 1800-222-990.

The notice is further given that pursuant to provisions of section 91 of the Companies Act, 2013 read with rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, the register of Members and share transfer books of the company will remain close from Tuesday, 23rd September, 2025 to Tuesday 30th September 2025 (both days inclusive) in connection with AGM.

Record date: Pursuant to Section 91 of the companies act, 2013 read with rules made there under and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the Company has fixed Friday, 10th October 2025 as the Record Date to determine the eligible Shareholders of the Company for the allotment of Bonus Equity Shares in the ratio of 7 (Seven) new Equity Shares of Face Value of Rs. 10/- each for every 5 (Five) existing Equity Share of Face Value of Rs. 10/- each held by the shareholders of the Company.

For, Laxmi Goldorna House Limited  
Sd/-  
Jayeshkumar Chinulal Shah  
Managing Director - DIN: 02479865

Date: 06/09/2025  
Place: Ahmedabad

**CHANGE OF NAME**  
I have changed my old name from **HETALKUMARI JAGDISHBHAI PATEL** to new name **HETALBEN HARIDIKBHAI PATEL**  
Add. Karnavati Park Ghodasar, Ahmedabad-380050  
2328

**CHANGE OF NAME**  
I have changed my old name from **KALAWANT SHAHBAZKHAKA SHAHBAZKHAN MOINUDDIN** to new name **KALAWANT SHAHBAZKHAN MOINUDDIN KHAN**  
Add. 4, Sahr Duplex Sarkhej road Ahmedabad-380055  
2329

**CHANGE OF NAME**  
I have changed my old name from **QURESHI NASRIN MOHAMMAD SHARIF** to new name **QURESHI NASREEN**  
Add. 108/545, Gujarat Housing Board, Bapunagar Ahmedabad-380024  
2330

**GCCL CONSTRUCTION & REALITIES LTD**  
CIN: L45201GJ1994PLC023416  
Regd. Office: A/115 Siddhi Vinayak Towers, Bh DCP Office, Off SG Highway, Makarba, Ahmedabad- 380051  
Contact: 079-29703131/3232  
Website: [www.gcclconstruction.com](http://www.gcclconstruction.com), Email: [info@gcclconstruction.com](mailto:info@gcclconstruction.com)

**NOTICE**  
Notice is hereby given that the 31st Annual General Meeting of GCCL Construction & Realities Limited will be held on **Tuesday, 30 September, 2025 at 01:00 p.m.** at the Registered Office of the Company to transact the business, set out in the Notice of the AGM.

The Notice of the AGM along with the Annual Report 2025 is being sent by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/ Depositories. Annual Report will also be available on the website of the Company at [www.gcclconstruction.com](http://www.gcclconstruction.com), BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and CDSL at [www.evotingindia.com](http://www.evotingindia.com). Remote e-voting facility is provided to Members to cast their votes on any of the resolutions set out in the Notice of the AGM. Members have an option to cast their vote using the remote e-voting facility prior to the AGM. Detailed procedure for remote e-voting is provided in the Notice of the AGM. Members who are holding shares in physical form or who have not registered their email addresses with the Company can cast their vote through physical voting during the meeting in the manner as provided in the notice of AGM.

The voting period begins on **27 September, 2025 from 09:00 a.m. and ends on 29 September, 2025 at 05:00 p.m.** During this period shareholders' of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date (record date) **19 September, 2025** may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. In case you have not registered your e-mail address please follow the below instructions:

Dematerialised holding	Register/update the details in your demat account, as per the process advised by your Depository Participant (DP)
Physical Holding	Send a duly signed request letter in Form ISR-1 along with supporting documents to the RTA of the Company i.e. Bigshare Services Pvt Ltd at A-802, Samudra Complex, off C.G Road, Navrangpura, Near Girish Gold Drinks, Ahmedabad 380009 and provide the following details/ documents for registering email address a) Folio No. b) Name of shareholder, c) Email ID, d) Copy of PAN card (self attested), e) Copy of Aadhar (self attested), f) Copy of share certificate (front and back) Following additional details/documents need to be provided in case of updating Bank Account details: a) Name and Branch of the Bank in which you wish to receive the dividend, b) the Bank Account number, c) Bank Account Number, d) MICR Code Number, e) IFSC Code and f) Copy of the cancelled cheque bearing the name of the first shareholder

Notice is also given that Register or Members and the Share transfer books of the Company will remain closed from **Wednesday, 24 September 2025 to Tuesday 30 September 2025** (both days inclusive) for the purpose of Annual General Meeting. If you have any dispute against the company and or its Registrar and Share Transfer Agent (RTA) on delay or default in processing your request, as per SEBI circular dated 30.05.2022, you can file for arbitration with Stock Exchange. For more details, please see the web links of the stock exchanges: BSE: [https://www.bseindia.com/static/investors/arbitration\\_mechanism.aspx](https://www.bseindia.com/static/investors/arbitration_mechanism.aspx). You may further write to the Company on [info@gcclconstruction.com](mailto:info@gcclconstruction.com). The above information is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the MCA Circulars and the SEBI Circulars issued from time to time.

Date: 06/09/2025  
Place: Ahmedabad  
Sd/- For GCCL Construction & Realities Ltd  
Devang Jhaveri, Whole time Director

**WESTERN RAILWAY - RAJKOT DIVISION**  
Tender Notice No.DRM/RJT/E-Tender/2025-2026/25 (EL) Dt. 04.09.25  
**PROVISION OF TERMINATING TRAIN EXAMINATION FACILITIES**  
Tender No.: DRM/RJT/EL/2025-2026/25  
Name of Work: Rajkot Division: Hapa, Jamnagar & Okha - Provision of Terminating Train Examination facilities.  
Approx. Cost: EMD Cost:  
Date & time for on line apply: on 03.10.2025 up to 15.00 Hours  
Address of the Office: Divisional Railway Manager (Electrical), Western Railway, Kothi Compound, Rajkot - 360 001  
Website particulars: [www.ireps.gov.in](http://www.ireps.gov.in) RJT 114  
Like us on: [facebook.com/WesternRly](https://facebook.com/WesternRly) - Follow us on: [twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

**WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION**  
E-Tender No.: BVP-EL-P-14-2025-26  
**IMPROVEMENT OF SAFETY IN ELECTRICAL ASSETS**  
Name of Work: Bhavnagar Division:-Improvement of Safety in Electrical assets in Staff quarters/service building and railway colony/yard/shed.  
Tender Value (Rs.): ₹ 22978083 EMD Rs.: ₹ 264900  
Date of Bidding Start Date: 12/09/2025  
Date of Bidding Closing: 26/09/2025  
The NIT is uploaded on Rly. Website [www.ireps.gov.in](http://www.ireps.gov.in) on 04/09/2025 BVP 125  
Like us on: [facebook.com/WesternRly](https://facebook.com/WesternRly) - Follow us on: [twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

**Gujarat State Road Development Corporation Ltd.**  
(Govt. of Gujarat Undertaking)  
Ground Floor, Nirman Bhavan, Sector No.10 A, Gandhinagar  
National Competitive Bidding  
Tender Notice (through E-Tendering only- 113/2025-26  
Gujarat Government has taken a major step towards boosting connectivity and infrastructure development by announcing Six Expressway Projects worth ₹. 93,240/- Crores, These Projects, The Namo Shakti Expressway and the Somnath Dwarka Expressway. The Government of Gujarat has entrusted GSRDC for "Engagemet consultant for all Forest Clearance Activities for Package-1 to 6" for Namo Shakti Expressway and the Somnath-Dwarka Expressway. Now, the GSRDC is e-inviting the bidding process for Package 1 & 6 for selection of a private entity as the bidder to whom the project may be awarded, Brief Particulars of the Project are as follows:

Name of Work	Bid Security (Rs.in Crs.)	Tender fee (Rs.)	a.bid document downloading start Date& Time b.online Bid submission last Date & Time c.Opening of bid (Online), Date and Time (Probable)
Engagement of consultant for all Forest Clearance Activities for Package-5 Ahmedabad to Rajkot Length-170 Km. of Proposed Dwarka Somnath Expressway	25000/-	1500/- +18% GST= 1770/-	a.Date 06/09/2025 from 12:00 Hrs b.Date 20/09/2025, Till 17:00 Hrs c. Date 20/09/2025, at 17:30 Hrs
Engagement of consultant for all Forest Clearance Activities for Package-6 Jetpur to Somnath Length-110 Km. of Proposed Dwarka Somnath Expressway.	25000/-	1500/- +18% GST= 1770/-	

Note: Tender Details are available online on website <https://tender.nprocure.com> All bid Documents, DD towards Tender Fee, bid security and Other Documents etc. should be submitted duly scanned with bid documents online at above website without which bid will not be opened, EMD exemption certificate shall not be entertained. The competent authority reserves the right, to reject all or any bid without assigning any Reasons thereof.

Bid submitted through any other mode shall not be entertained, However, original Bid Security, original Demand Draft towards cost of bid document, Power of Attorney and joint bidding agreement etc. as specified in RFP shall be submitted physically by the Bidder on or before **26/09/2025** to GSRDC through **RPAD/Speed Post** Only and no other mode of submission shall be accepted. Please note that GSRDC reserves the right to accept or reject all or any of the BIDs without assigning any reason whatsoever.

INF/1333/2025-26

**GUJARAT CREDIT CORPORATION LTD**  
CIN: L72900GJ1993PLC020564  
Regd. Office: A/115 Siddhi Vinayak Towers, Bh DCP Office, Off SG Highway, Makarba, Ahmedabad- 380051  
Contact: 079-29703131/3232  
Website: [www.gccl.co.in](http://www.gccl.co.in), Email: [gujaratcredit@gmail.com](mailto:gujaratcredit@gmail.com)

**NOTICE**  
Notice is hereby given that the 32nd Annual General Meeting of Gujarat Credit Corporation Ltd will be held on **Tuesday, September 30, 2025 at 11:00 a.m.** at the Registered Office of the Company to transact the business, set out in the Notice of the AGM.

The Notice of the AGM along with the Annual Report 2025 is being sent by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/ Depositories. Annual Report will also be available on the website of the Company at [www.gccl.co.in](http://www.gccl.co.in), BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and CDSL at [www.evotingindia.com](http://www.evotingindia.com). Remote e-voting facility is provided to Members to cast their votes on any of the resolutions set out in the Notice of the AGM. Members have an option to cast their vote using the remote e-voting facility prior to the AGM. Detailed procedure for remote e-voting is provided in the Notice of the AGM. Members who are holding shares in physical form or who have not registered their email addresses with the Company can cast their vote through physical voting during the meeting in the manner as provided in the notice of AGM.

The voting period begins on **September 27, 2025 from 09:00 a.m. and ends on September 29, 2025 at 05:00 p.m.** During this period shareholders' of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date (record date) **September 19, 2025** may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. In case you have not registered your e-mail address please follow the below instructions:

Dematerialised holding	Register/update the details in your demat account, as per the process advised by your Depository Participant (DP)
Physical Holding	Send a duly signed request letter in Form ISR-1 along with supporting documents to the RTA of the Company i.e. Bigshare Services Pvt Ltd at A-802, Samudra Complex, off C.G Road, Navrangpura, Near Girish Gold Drinks, Ahmedabad 380009 and provide the following details/ documents for registering email address a) Folio No. b) Name of shareholder, c) Email ID, d) Copy of PAN card (self attested), e) Copy of Aadhar (self attested), f) Copy of share certificate (front and back) Following additional details/documents need to be provided in case of updating Bank Account details: a) Name and Branch of the Bank in which you wish to receive the dividend, b) the Bank Account number, c) Bank Account Number, d) MICR Code Number, e) IFSC Code and f) Copy of the cancelled cheque bearing the name of the first shareholder

Notice is also given that Register or Members and the Share transfer books of the Company will remain closed from **Wednesday, September 24 2025 to Tuesday, September 30, 2025** (both days inclusive) for the purpose of Annual General Meeting. If you have any dispute against the company and or its Registrar and Share Transfer Agent (RTA) on delay or default in processing your request, as per SEBI circular dated 30.05.2022, you can file for arbitration with Stock Exchange. For more details, please see the web links of the stock exchanges: BSE: [https://www.bseindia.com/static/investors/arbitration\\_mechanism.aspx](https://www.bseindia.com/static/investors/arbitration_mechanism.aspx). You may further write to the Company on [gujaratcredit@gmail.com](mailto:gujaratcredit@gmail.com). The above information is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the MCA Circulars and the SEBI Circulars issued from time to time.

Date: 06/09/2025  
Place: Ahmedabad  
Sd/- For Gujarat Credit Corporation Ltd  
Amam Shah, Managing Director

**WESTERN RAILWAY - AHMEDABAD DIVISION**  
E-TENDER NOTICE No. 10 OF 2025-26 DATED: 02.09.2025  
**SCHEDULE PAINTING WORK OF ROBS (COMPOSITE)**  
E-Tender No.: DYCE-BR-ADI-04-2025-26-R  
Name of work: Ahmedabad Division: Schedule Painting work of ROBs (Composite) in MSH-PTN, MSH-VG, PNU-BLDI & GIMB-BHUJ - NLC section under jurisdiction of SSE (Bridge) Ahmedabad.  
Approximate NIT Cost: ₹ 40,17,211.01  
Bid Security Cost/EMD: ₹ 80,400.00  
Closing date & time of e-tender: Date 30.09.2025 Time 15:00 hrs  
Office Address: Deputy Chief Engineer (Bridges) Ahmedabad, Divisional Railway Manager Office Complex, Opposite Gujarat Cancer Society Hospital, Asarwa, Naroda Road, Amdapura, Ahmedabad, Gujarat 380016.  
Website for participating e-tender: [www.ireps.gov.in](http://www.ireps.gov.in) ADI 148  
Like us on: [facebook.com/WesternRly](https://facebook.com/WesternRly) - Follow us on: [twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

**Gujarat Water Supply and Sewerage Board, Gandhinagar**  
Executive Engineer, P.H.W.D.N., Bhuj  
Tender Notice No.05 Year 2025-26  
Ph. (02832) 252310 Mob.9978407847  
Executive Engineer, Public Health Works Division, Bhuj Kutch through e-tendering system in Work for  
"Providing, Supplying, lowering laying and jointing & Fixing 100 m.m dia D.I.Pipe line, Pumping machinery, RCC Pump house and Electrification work for BSF Sedata CAMPUS W.S. Under Deposit work year 2025-26"  
Estimated Cost Rs.54.10,306.32 (Tender I.D.No.221301)  
Tender can be downloaded after Dt.04/09/2025 17:00 Hours. Last Date of online Submission is till Dt.25/09/2025 at 18:00 Hours. Further details are available on the Website <https://tender.nprocure.com>  
Regarding the problem of drinking water in rural areas, It is requested to, contact the helpline no.1916/1800 200 1400 of Gujarat Water Supply & Sewerage Board, Gandhinagar.  
DDI/KUTCH/709/2025-26

**Gujarat Biotechnology Research Center**  
Dept. of Science & Technology, Govt. of Gujarat  
M.S. Building, Sector-11  
Gandhinagar-382011, Gujarat  
**Advertisement for Recruitment of Project Manager (01), Project Scientist III (01), Research Associate (3), Junior Research Fellow (04), Staff Nurse (02), Field Worker (02), Data Entry Operator (01) and Administrative Assistant (01)**

Gujarat Biotechnology Research Center invites applications from the interested candidates for the above mentioned posts through online applications only. Please visit <https://gbrcc.gujarat.gov.in> for online application, project details and eligibility criteria.  
Start Date of Submission of Online Application: 04-09-2025  
Last Date of Submission of Online Application: 24-09-2025

INF/1330/2025-26

**WESTERN RAILWAY - AHMEDABAD DIVISION**  
E-Tender NIT Number: ELS-VTA-25-26-Bogie dated 03.09.2025  
**WORKS CONTRACT FOR DISCONNECTION, DISMANTLING AND CLEANING OF BOGIE FRAME AND ITS COMPONENTS OF ELECTRIC LOCOMOTIVES**  
Tender Number: M-ELS-VTA-25-26-Bogie, dated 03.09.2025  
Name of Work: Works contract for Disconnection, dismantling and cleaning of bogie frame and its components of electric locomotives Loco Shed Vatva for 03 years.  
Estimated Cost of Work: ₹ 48,38,953.84/- (Including all Taxes/GST)  
Cost of Tender Document: Nil  
Earnest Money Deposit: ₹ 96,800/-  
Period of Completion: 36 Months  
Last Date of Submission of Tender: 25/09/2025 at 14:00 Hrs  
Tender Inviting Authority & its complete address: Senior Divisional Mechanical Engineer, Electric Loco Shed Vatva, Office of Sr.DME/ELS/VTA, Electric Loco Shed, Vatva, Western Railway, Ahmedabad, Gujarat - 382445  
Website Particulars: [www.ireps.gov.in](http://www.ireps.gov.in) ADI 150  
Like us on: [facebook.com/WesternRly](https://facebook.com/WesternRly) - Follow us on: [twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

**GCCL INFRASTRUCTURE AND PROJECTS LIMITED**  
CIN: L45400GJ1994PLC023416  
Registered Office: A-115, Siddhi Vinayak Towers, B/H, DCP Office, Off S.G. Highway, Makarba, Ahmedabad, Gujarat, India, 380051. Office No: 079-29703131  
Website: [www.gcclinfra.com](http://www.gcclinfra.com) Email: [gcclinfrastructure@gmail.com](mailto:gcclinfrastructure@gmail.com)

### NOTICE OF 31st ANNUAL GENERAL MEETING TO BE HELD AT THE REGISTERED OFFICE OF THE COMPANY AND BOOK CLOSURE

NOTICE is hereby given that the 31st Annual General Meeting ("AGM") of the members of **GCCL INFRASTRUCTURE AND PROJECTS LIMITED** will be held on **Tuesday, September 30th, 2025 at 11:00 a.m. (IST)** at registered office of the Company situated at A-115, Siddhi Vinayak Towers, B/H, DCP Office, Off S.G. Highway, Makarba, Ahmedabad, Gujarat, India, 380051 to transact the business as set forth in the Notice of the Annual General Meeting.

In Compliance with MCA Circulars and SEBI Circulars, the Notice of the 31st AGM along with the Annual Report (F.Y. 2024-25) has been sent on September 05th, 2025 through electronic mode only to those Members whose e-mail addresses are registered with the Company or Registrar & Transfer Agent and Depositories. The Annual Report for financial year 2024-2025 containing the Notice of AGM is available on the company's website at [www.gcclinfra.com](http://www.gcclinfra.com). The Notice convening the AGM is also available on the websites of Central Depository Services (India) Limited (CDSL) at [www.evotingindia.com](http://www.evotingindia.com) and BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com). The Company is pleased to provide remote e-voting facility to all its members to enable them to cast their vote on all matters listed in the said Notice before as well as during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed CDCL for facilitating voting through electronic means.

The details regarding the e-voting facility is provided below:  
a. The remote e-voting facility will be available during the following period:

Cut-off date for determining the Members entitled to vote	Tuesday, September 23rd, 2025
Commencement of e-voting period	Saturday, September 27th, 2025 at 09.00 a.m. (IST)
End of e-voting period	Monday, September 29th, 2025 at 05.00 p.m. (IST)

The e-voting will be disabled by CDCL after 5:00 p.m. on Monday, September 29th, 2025 and the Members shall not be allowed to vote beyond the said date and time.

b. The voting rights of the Members shall be in proportion to their share of the paid-up equity share capital of the Company as on Tuesday, September 23rd, 2025 ("Cut-Off Date"). The facility of e-voting will also be made available during the AGM and the Members attending the AGM, who have not cast their vote through remote e-voting shall be eligible to exercise their right during the Meeting. A person whose name is recorded in the Register of Members / Register of Beneficial Owners as on the Cut-Off Date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.

c. Any person who acquires shares of the Company and becomes a Member of the Company after the dispatch of the Notice and holds shares as on the Cut-Off Date, may obtain the login-id and password for remote e-Voting by sending a request at [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com), as provided by CDCL.

d. Members who have cast their vote by remote e-Voting prior to the AGM may also attend the AGM electronically, but shall not be entitled to vote again.

### PROCESS FOR THOSE SHAREHOLDERS WHOSE EMAIL ADDRESSES ARE NOT REGISTERED WITH THE DEPOSITORIES FOR OBTAINING LOGIN CREDENTIALS FOR VOTING FOR THE RESOLUTIONS PROPOSED IN THIS NOTICE

1. For Physical shareholders please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to [gcclinfrastructure@gmail.com](mailto:gcclinfrastructure@gmail.com).

2. For Demat shareholders, please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (Self-attested scanned copy of Aadhar Card) to [gcclinfrastructure@gmail.com](mailto:gcclinfrastructure@gmail.com). Further Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Register of Members and Share Transfer Books will remain closed from Wednesday, 24th September, 2025 to Tuesday, 30th September, 2025 (both days inclusive).

Members are requested to carefully read all the Notes which are set out in the Notice of the AGM and instructions for joining the AGM, manner of casting votes through remote e-voting during AGM.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDCL e-Voting System, you can write an email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or contact at 022-



# અરવલ્લી જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત રિઝનલ કોન્ફરન્સનું આયોજન

રૂા. ૪૬૯.૨૩ કરોડના MOU થકી ૧૩૦૦ લોકોને રોજગારીની તક

**પ્રતિનિધિ. મોડાસા,** અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત રિઝનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન યોજાયું. આ કોન્ફરન્સમાં ઉદ્યોગ અને ભાષા-ખનીજ વિભાગ દ્વારા કુલ ૧૦ MOU પર હસ્તાક્ષર થયા, જેમાં ઉદ્યોગ વિભાગના ૫ MOU થકી ૩૪૪.૨૩ કરોડ અને ભાષા-ખનીજ વિભાગના ૫ MOU થકી ૧૨૫ કરોડનું રોકાણ થશે. આ પ્રોજેક્ટ્સ રાજા અંદાજિત ૧૩૦૦ લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે, જે અરવલ્લી જિલ્લાના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપશે.

કોન્ફરન્સનું ઉદ્ઘાટન સુશ્રી તન્વી પટેલ, સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લી દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવ્યું. તેમણે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા અને તેના રિઝનલ સ્તરે વિસ્તરણની વિગતો આપી. તેમણે જણાવ્યું કે આ પહેલથી નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, જે નાથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે.

શ્રી સ્વરૂપ પી. (IAS), ઉદ્યોગ કમિશનર,એ સંબોધનમાં જણાવ્યું, “૨૦૦૩માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત આજે રિઝનલ સ્તરે પહોંચી છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એક સામૂહિક પ્લેટફોર્મ ઊભું થયું છે, જે સ્કિલ ડેવલપમેન્ટ, ગુજરાત આજે દેશ-વિદેશમાં



(તસ્વીર: કોશિક પટેલ, મોડાસા)

MSME, અને લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે નવી તકો ખોલી રહ્યું છે. આજે આ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.”

રૂપવંત સિંહ (IAS), મેનેજિંગ ડિરેક્ટર, GMDP, અમદાવાદ,એ જણાવ્યું, “આજે આપણે AINA યુગમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છીએ. છેલ્લા ૧૦૦ વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે અનેક બદલાવ આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રિઝનલ સ્તરે આયોજન એ સફળ નેતૃત્વનું પરિણામ છે. આ પહેલથી ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે.”

કલેક્ટર પ્રશસ્તિ પારિકે જણાવ્યું, “આ રિઝનલ કોન્ફરન્સ અરવલ્લી જિલ્લાના વિકાસની મિસાલ છે. આ પહેલથી જિલ્લાના ઉદ્યોગો અને રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થશે. અરવલ્લી જિલ્લા આજે ઔદ્યોગિક વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.”

મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે સંબોધનમાં ઉમેર્યું, “માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી વાયબ્રન્ટ ગુજરાત આજે દેશ-વિદેશમાં

નામના મેળવી રહી છે. આજે કરોડોના MOU થકી ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આવી કોન્ફરન્સથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી રહ્યો છે, અને ગુજરાત આર્થિક પ્રગતિના

## સાબરકાંઠા જિલ્લામાં અનેક ઠેકાણે ગણપતિ વિસર્જન અંતર્ગત શોભાયાત્રા નિકળી

(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં શનિવારે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતી થઈ હતી. ત્યારે હિંમતનગર, ઈડર સહિત જિલ્લાના વિવિધ સ્થળે શનિવારે વરસતા વરસાદમાં

પણ ગણેશ ભક્તોએ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને ગણપતિના ગુણગાન ગાઈ તેમને વિદાય આપવામાં આવી હતી. જેના ભાગરૂપે હિંમતનગરમાં વિવિધ સ્થળે યોજાયેલ ગણપતિ વિસર્જન યાત્રા નિકળી હતી. જે શહેરના વિવિધ

માર્ગો પર થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયા બાદ અનેક ગણપતિ યુવક મંડળો તથા સોસાયટીવાસીઓએ ગણપતિની મૂર્તિને હિંમતનગરના બદલે ઈડર, સમેથર, રાયઘડ સહિતના અન્ય સ્થળે જઈ મંત્રોચ્ચાર સાથે ગણપતિ વિસર્જન કર્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે

નવા શિખરો સર કરી રહ્યું છે.” આ કોન્ફરન્સમાં માનનીય શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, અરવલ્લી, સુશ્રી સ્નેહલબેન પટેલ, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, મોડાસા; શ્રી નિરજ શેઠ, પ્રમુખશ્રી, નગરપાલિકા, મોડાસા; શ્રી ભિખાજી દુધાજી ડામોર, પ્રમુખશ્રી, અરવલ્લી જિલ્લા ભાજપ; માનનીય કલેક્ટરશ્રી, અરવલ્લી; માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અરવલ્લી; શ્રી કનુભાઈ પટેલ, પ્રમુખશ્રી, ચેમ્બર ઓફ કોમર્સ; શ્રી ફલ્ગુદેભાઈ કણવા, મેનેજિંગ ડિરેક્ટર, શ્રીનંદે કંપની; શ્રી નિરજ શેઠ, મેનેજિંગ ડિરેક્ટર, વી હિયર ઈનોવેશન પ્રા. લિ. ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



મંડળો દ્વારા ગણપતિ વિસર્જન કરવા માટે ઈડરના સમેથર તથા ગાંધોઈ પાસેના રાયઘડ તળાવની પસંદગી કરવામાં આવી હતી. શનિવારે વરસાદ ચાલુ હોવા છતાં પ્રાંતિજ તાલુકાના સોનાસણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નિકળેલી શોભાયાત્રામાં અનેક પુરુષો, મહિલાઓ અને યુવાઓએ ઉપસ્થિત રહી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી ગણપતિ વિસર્જનમાં ભાગ લીધો હતો.



અનંત રીડેસ એટેલેટ કે ગણપતિ મહોત્સવનો વિસર્જનનો દિવસ આજે અરવલ્લી જિલ્લાના અનેક ગણપતિ મંદિરોમાં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી અને તેમને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલા મહારાષ્ટ્રીન સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે સમસ્ત ગુજરાત રાજ્ય જાહેર સમાજ કોરકમિટી ના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પીટ અગ્રણી કાર્ડફર્ટ એવા અતુલભાઈ દીક્ષિતે એ સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લઈ પૂજા અર્ચના કરી ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સિદ્ધિ વિનાયક મંદિરના સચિન મહારાષ્ટ્ર અને ટ્રસ્ટીઓ એ અતુલભાઈ દીક્ષિત નું ખેસ પહેવારી સ્વાગત કર્યું હતું.

(તસ્વીર: કોશિક પટેલ, મોડાસા)

**GUJARAT CREDIT CORPORATION LTD**  
CIN: L72900GJ2001PLC0059513  
Regd. Office: A/115 Siddhi Vinayak Towers, Bh DCP Office, Off SG Highway, Makarba, Ahmedabad- 380051  
Contact: 079-29703131/3232  
Website: www.gcccl.co.in, Email: gujaratcredit@gmail.com

**NOTICE**  
Notice is hereby given that the 32nd Annual General Meeting of Gujarat Credit Corporation Ltd will be held on **Tuesday, September 30, 2025 at 11:00 a.m.** at the Registered Office of the Company to transact the business, set out in the Notice of the AGM.

The Notice of the AGM along with the Annual Report 2025 is being sent by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Annual Report will also be available on the website of the Company at [www.gcccl.co.in](http://www.gcccl.co.in), BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and CDSL at [www.evotingindia.com](http://www.evotingindia.com)

Remote e-voting facility is provided to Members to cast their votes on any of the resolutions set out in the Notice of the AGM. Members have an option to cast their vote using the remote e-voting facility prior to the AGM. Detailed procedure for remote e-voting is provided in the Notice of the AGM. Members who are holding shares in physical form or who have not registered their email addresses with the Company can cast their vote through physical voting during the meeting in the manner as provided in the Notice of AGM.

The voting period begins on **September 27, 2025 from 09:00 a.m. and ends on September 29, 2025 at 05:00 p.m.** During this period shareholders' of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date (record date) **September 19, 2025** may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. In case you have not registered your e-mail address please follow the below instructions:

Dematerialised holding	Register/update the details in your demat account, as per the process advised by your Depository Participant (DP)
Physical Holding	Send a duly signed request letter in Form ISR-1 along with supporting documents to the RTA of the Company i.e. Bigshare Services Pvt Ltd at A-802, Samudra Complex, off C G Road, Navrangpura, Near Girish Cold Drinks, Ahmedabad 380009 and provide the following details/documents need to be provided in case of updating Bank Account details: a) Name and Branch of the Bank in which you wish to receive the dividend, b) the Bank Account number, c) Bank Account Number, d) MICR Code Number, e) IFSC Code and f) Copy of the cancelled cheque bearing the name of the first shareholder

Notice is also given that Register or Members and the Share transfer books of the Company will remain closed from **Wednesday, September 24 2025 to Tuesday, September 30, 2025** (both days inclusive) for the purpose of Annual General Meeting. If you have any dispute against the company and or its Registrar and Share Transfer Agent (RTA) on delay or default in processing your request, as per SEBI circular dated 30.05.2022, you can file for arbitration with Stock Exchange. For more details, please see the web links of the stock exchanges: BSE: [https://www.bseindia.com/static/investors/arbitration\\_mechanism.aspx](https://www.bseindia.com/static/investors/arbitration_mechanism.aspx). You may further write to the Company on [gujaratcredit@gmail.com](mailto:gujaratcredit@gmail.com).

The above information is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the MCA Circulars and the SEBI Circulars issued from time to time.

**Date: 06/09/2025** **Sd/- For Gujarat Credit Corporation Ltd**  
**Place: Ahmedabad** **Amam Shah, Managing Director**

# ભરૂચમાં ત્રણ કુત્રિમ જળકુંડમાં શ્રીજી પ્રતિમાઓનું શ્રદ્ધા ભર્યા માહોલમાં વિસર્જન

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર - જિલ્લામાં ભક્તજનોએ શિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને દસ દિવસના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હઠયે ગણપતિ બાપ્પા મોરિયા અગલે ભરસ તું જલદી આના ના નારા ઓ સાથે વિદાય આપી હતી. જે મોડી રાત્રી સુધી વિસર્જન પ્રક્રિયા ચાલુ રહી હતી.

ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ કુત્રિમ જળકુંડમાં ચુંનદા તરવેયાના સથવારે સુચારુ રૂપે વિસર્જન કાર્ય ધરાયું હતું. ગણેશ ચતુર્થીના પાવન દિને પ્રથમ પૂજનીય ગણેશજીનું સ્થાપન કરી દસ દિવસ સુધી ગણેશ ભક્તિમાં લીન થઈ અનંત ચતુર્થીના દિવસે શ્રદ્ધાભર્યા માહોલમાં આવતા વર્ષ પુનઃ પધારવાના વચન



(તસ્વીર: વિરલ સાલા, ભરૂચ)

સાથે રડતા હેયે ભક્તોએ વિદાય આપી હતી.

નગરપાલિકા દ્વારા ભરૂચના મકતમપુર, જે.બી.મોડી પાર્ક તેમજ ગાયત્રી મંદિર પાસે ત્રણ

## ચકલાસી પાલિકામાં પ્રમુખ તરીકે પ્રવીણભાઈ વાઘેલા બિનહરીફ ચૂંટાયેલા જાહેર



(તસ્વીર: સાહુદે એચદ, નડિયાદ)

(પ્રતિનિધિ) નડિયાદ, ચકલાસી નગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષમાં ભરકો થયો હતો અને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ હતી જેથી પ્રમુખ રાજીનામું મૂકી દીધું હતું આ ખાલી પડેલી બેઠક માટે આજે નડિયાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના વોર્ડ નંબર ૩ માં ચૂંટાયેલા સભ્ય ને ભાજપે મેરેડ આપતા તેઓ બિનહરીફ બન્યા છે

ચકલાસી નગરપાલિકા ની તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ નારોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં કુલ ૨૮ બેઠકો પૈકી ૧૬ બેઠકો ભાજપને મળી હતી પાલિકામાં પ્રથમ વખત જ ભાજપને પૂર્ણ હુકમતી મળી હતી ત્યાર પછી પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે તારીખ ૫ માર્ચ ના રોજ ચૂંટણી

## વેસ્ટર્ન ટાઇમ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

**GCCL INFRASTRUCTURE AND PROJECTS LIMITED**  
CIN: L45400GJ1994PLC023416  
Registered Office: A-115, Siddhi Vinayak Towers, B/H. DCP Office, Off S.G. Highway, Makarba, Ahmedabad, Gujarat, India, 380051  
Office No: 079- 29703131  
Website: www.gccclinfra.com Email: gccclinfrastructure@gmail.com

**NOTICE OF 31st ANNUAL GENERAL MEETING TO BE HELD AT THE REGISTERED OFFICE OF THE COMPANY AND BOOK CLOSURE**

NOTICE is hereby given that the 31st Annual General Meeting ("AGM") of the members of **GCCL INFRASTRUCTURE AND PROJECTS LIMITED** will be held on **Tuesday, September 30th, 2025 at 11:00 a.m. (IST)** at the registered office of the Company situated at A-115, Siddhi Vinayak Towers, B/H. DCP Office, Off S.G. Highway, Makarba, Ahmedabad, Gujarat, India, 380051 to transact the business as set forth in the Notice of the Annual General Meeting.

In Compliance with MCA Circulars and SEBI Circulars, the Notice of the 31st AGM along with the Annual Report (FY. 2024-25) has been sent on September 05th, 2025 through electronic mode only to those Members whose e-mail addresses are registered with the Company or Registrar & Transfer Agent and Depositories. The Annual Report for financial year 2024-2025 containing the Notice of AGM is available on the company's website at [www.gccclinfra.com](http://www.gccclinfra.com). The Notice convening the AGM is also available on the websites of Central Depository Services (India) Limited (CDSL) at [www.evotingindia.com](http://www.evotingindia.com) and BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com).

The Company is pleased to provide remote e-voting facility to all its members to enable them to cast their vote on all matters listed in the said Notice before as well as during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed CDSL for facilitating voting through electronic means. The details regarding the e-voting facility is provided below:

a. The remote e-voting facility would be available during the following period:

Cut-off date for determining the Members entitled to vote	Tuesday, September 23rd, 2025
Commencement of e-voting period	Saturday, September 27th, 2025 at 09:00 a.m. (IST)
End of e-voting period	Monday, September 29th, 2025 at 05:00 p.m. (IST)

The e-voting will be disabled by CDSL after 5:00 p.m. on Monday, September 29th, 2025 and the Members shall not be allowed to vote beyond the said date and time.

b. The voting rights of the Members shall be in proportion to their share of the paid-up share capital of the Company as on Tuesday, September 23rd, 2025 ("Cut-Off Date"). The facility of e-voting will also be made available during the AGM and the Members attending the AGM, who have not cast their vote through remote e-voting shall be eligible to exercise their right during the Meeting. A person whose name is recorded in the Register of Members / Register of Beneficial Owners as on the Cut-Off Date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM;

c. Any person who acquires shares of the Company and becomes a Member of the Company after the dispatch of the Notice and holds shares as on the Cut-Off Date, may obtain the login-id and password for remote e-voting by sending a request at [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com), as provided by CDSL.

d. Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM electronically, but shall not be entitled to vote again.

**PROCESS FOR THOSE SHAREHOLDERS WHOSE EMAIL ADDRESSES ARE NOT REGISTERED WITH THE DEPOSITORIES FOR OBTAINING LOGIN CREDENTIALS FOR VOTING FOR THE RESOLUTIONS PROPOSED IN THIS NOTICE**

1. For Physical shareholders please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to [gccclinfrastructure@gmail.com](mailto:gccclinfrastructure@gmail.com).  
2. For Demat shareholders, please provide Demat account details (CDSL-16 digit beneficial ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (Self-attested scanned copy of Aadhar Card) to [gccclinfrastructure@gmail.com](mailto:gccclinfrastructure@gmail.com).  
Further Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Register of Members and Share Transfer Books will remain closed from Wednesday, 24th September, 2025 to Tuesday, 30th September, 2025 (both days inclusive).

Members are requested to carefully read all the Notes which are set out in the Notice of the AGM and instructions for joining the AGM, manner of casting votes through remote e-voting during AGM.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDSL e-Voting System, you can write an email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or contact at 022-23058738 and 022-23058542/43.

**FOR, GCCL INFRASTRUCTURE AND PROJECTS LIMITED**  
Sd/-  
**Amam Shreyans Shah,**  
**DIRECTOR/CEO**  
Din: 01617245

**Place: Ahmedabad**  
**Date: 05th September, 2025**

**GCCL CONSTRUCTION & REALITIES LTD**  
CIN: L45201GJ1994PLC023414  
Regd. Office: A/115 Siddhi Vinayak Towers, Bh DCP Office, Off SG Highway, Makarba, Ahmedabad- 380051  
Contact: 079-29703131/3232  
Website: www.gccclconstruction.com, Email: info@gccclconstruction.com

**NOTICE**

Notice is hereby given that the 31st Annual General Meeting of GCCL Construction & Realities Limited will be held on **Tuesday, 30 September, 2025 at 01:00 p.m.** at the Registered Office of the Company to transact the business, set out in the Notice of the AGM.

The Notice of the AGM along with the Annual Report 2025 is being sent by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Annual Report will also be available on the website of the Company at [www.gccclconstruction.com](http://www.gccclconstruction.com), BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and CDSL at [www.evotingindia.com](http://www.evotingindia.com).

Remote e-voting facility is provided to Members to cast their votes on any of the resolutions set out in the Notice of the AGM. Members have an option to cast their vote using the remote e-voting facility prior to the AGM. Detailed procedure for remote e-voting is provided in the Notice of the AGM. Members who are holding shares in physical form or who have not registered their email addresses with the Company can cast their vote through physical voting during the meeting in the manner as provided in the notice of AGM.

The voting period begins on **27 September, 2025 from 09:00 a.m. and ends on 29 September, 2025 at 05:00 p.m.** During this period shareholders' of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date (record date) **19 September, 2025** may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. In case you have not registered your e-mail address please follow the below instructions:

Dematerialised holding	Register/update the details in your demat account, as per the process advised by your Depository Participant (DP)
Physical Holding	Send a duly signed request letter in Form ISR-1 along with supporting documents to the RTA of the Company i.e. Bigshare Services Pvt Ltd at A-802, Samudra Complex, off C G Road, Navrangpura, Near Girish Cold Drinks, Ahmedabad 380009 and provide the following details/documents for registering email address a) Folio No., b) Name of shareholder, c) Email ID, d) Copy of PAN card (self attested), e) Copy of Aadhar (self attested), f) Copy of share certificate (front and back) Following additional details/documents need to be provided in case of updating Bank Account details: a) Name and Branch of the Bank in which you wish to receive the dividend, b) the Bank Account number, c) Bank Account Number, d) MICR Code Number, e) IFSC Code and f) Copy of the cancelled cheque bearing the name of the first shareholder

Notice is also given that Register or Members and the Share transfer books of the Company will remain closed from **Wednesday, 24 September 2025 to Tuesday 30 September 2025** (both days inclusive) for the purpose of Annual General Meeting. If you have any dispute against the company and or its Registrar and Share Transfer Agent (RTA) on delay or default in processing your request, as per SEBI circular dated 30.05.2022, you can file for arbitration with Stock Exchange. For more details, please see the web links of the stock exchanges: BSE: [https://www.bseindia.com/static/investors/arbitration\\_mechanism.aspx](https://www.bseindia.com/static/investors/arbitration_mechanism.aspx). You may further write to the Company on [info@gccclconstruction.com](mailto:info@gccclconstruction.com).

The above information is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the MCA Circulars and the SEBI Circulars issued from time to time.

**Date: 06/09/2025** **Sd/- For GCCL Construction & Realities Ltd**  
**Place: Ahmedabad** **Devang Jhaveri, Whole time Director**

**રોબર્ટ રિસોર્સિસ લિમિટેડ**  
રજી. ઓફિસ :- ઓફિસ નંબર ૨૧૪ સેક્ટર ક્લોર, ધ્યા-સુપ્રી કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ભાવનગર બીપીઆઇ, ભાવનગર-૩૬૪૦૦૨, ગુજરાત. સંપર્ક નં. +91-6358995872  
ઈમેઇલ :- robertresourceslimited@gmail.com વેબસાઇટ :- www.robertresources.com  
CIN :- L-999999GJ1982PLC096012

**૪૩ મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ**

કંપનીની ૪૩ મી વાર્ષિક સામાન્યસભા (એ.ઝ.એમ.) અંગળવારે, તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫, સાંચાં ૧૧:૦૦ વાગ્યે, કંપનીના રજિસ્ટર્ડ ઓફિસ ખાતે યોજાશે. આ સભા સંબંધી અધિવેશન, ૨૦૧૩ ની લાગુ પડતી નોગવાઈઓ અને કોર્પોરેટ બાબતો મંત્રાલય (MCA) દ્વારા ના.પત્રો, ૨૦૨૦ અને ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ જારી કરાયેલા પરિપત્રો તથા SEBI પરિપત્ર તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૪ અને MCA તથા SEBI દ્વારા આ સંદર્ભમાં જારી કરવામાં આવેલા અન્ય લાગુ પડતા પરિપત્રોના પાલન સાથે યોજાશે (એકસાથે “પરિપત્રો”) તરીકે ઓળખવામાં આવે છે) જેથી વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં સૂચનામાં ઉલ્લેખિત મુજબ એ.ઝ.એમમાં નક્કી થયેલા વ્યવહારોને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મતદાન દ્વારા કરવામાં આવે.

ઉપરોક્ત પરિપત્રોના પાલનરૂપે, કંપનીની ૪૩ મી એ.ઝ.એમ ની નોટિસ અને વાર્ષિક અહેવાલ (FY ૨૦૨૪-૨૫), તેમજ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોકલવામાં આવ્યા છે જેઓએ પોતાના સંબંધિત ઇદ.ડી. ઇલેક્ટ્રોનિક અથવા કંપની / RTA સાથે નોંધાવ્યા છે.

૪૩મી એ.ઝ.એમની નોટિસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ [www.robertresources.com](http://www.robertresources.com), રટોક એક્સચેન્જ MSE લિમિટેડની વેબસાઇટ [www.mse.in](http://www.mse.in), [www.cse-india.com](http://www.cse-india.com) તેમજ સેન્ટ્રલ ડિપોઝિટી સર્વિસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) ની વેબસાઇટ [www.evotingindia.com](http://www.evotingindia.com) પર પણ ઉપલબ્ધ છે.

**ઈ-વોટિંગ દ્વારા મતદાન કરવાની રીત :**

કંપની તેના તમામ સભ્યોને “રિમોટ-ઈ-વોટિંગ” સુવિધા પૂરી પાડી રહી છે જેથી એ.ઝ.એમની નોટિસમાં નક્કી કરાયેલ તમામ કાર્ય પૂર્ણમાં આવી શકે. વિગતવાર પ્રક્રિયા એ.ઝ.એમની નોટિસમાં આપવામાં આવી છે. સભ્યો વાસ્તે વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ઈ-વોટિંગ સુવિધા અથવા રિમોટ-ઈ-વોટિંગ સુવિધાનો ઉપયોગ કરીને કોઈપણ હારાવ પર મતદાન કરવાનો વિકલ્પ છે. **રિમોટ ઈ-વોટિંગ સમયગાળો:**

શનિવાર, તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ (સપ્તાહના ૯:૦૦ વાગ્યાથી) થી લઈને સોમવાર, તા.૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ (સાંજના ૫:૦૦ વાગ્યા સુધી) રહેશે ત્યારબાદ CDSL દ્વારા ઈ-વોટિંગ મોડ્યુલ બંધ કરી દેવામાં આવી શકે.

**બુક ક્લોઝર અને કટ-ઓફ તારીખ:**